

ક્રિમીનલ ઇન્કવાયરી નં.૧૫૭/૨૦૨૨ ના કામે આંક-૧ તળે હુકમ

ફરીયાદ વંચાણે લીધી.ફરીયાદીની ફરીયાદ, ફરીયાદીનું વેરીફિકેશન, સોગંદનામું, રજુ થયેલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લીધા.

સદરહુ ફરીયાદ ફરીયાદી દ્વારા રજુ થતાં આંક-૧ તળેના હુકમ મુજબ સદરહુ ફરીયાદ રીટર્નમેમાના કારણ સંદર્ભે ઇન્કવાયરી તળે રાખવામાં આવેલી હતી. આ કામે રીટર્નમેમાનું કારણ જોતાં " 88-CHQ UNUSABLE " ના શેરા સાથે તકરારી ચેક પરત ફરેલો છે. આ સંદર્ભે ફરીયાદી માર્ક-૯/૧ થી આરોપી દ્વારા મેનેજરશ્રી, બેંક ઓફ બરોડા,અંધેરી કુર્લા રોડ, ચકલા, અંધેરી-ઈસ્ટ,મુંબઈ-૪૦૦ ૦૯૯ ને તા.૨૮/૧૦/૨૦૨૧ ના રોજ લખેલ પત્રની નકલ તથા આરોપીના બેંક એકાઉન્ટ નં.૦૫૮૮૦૨૦૦૦૦ ૧૩૯૩ નું સ્ટેટમેન્ટ રજુ કરવામાં આવેલું છે. આ બંને દસ્તાવેજો જોતાં આરોપી દ્વારા તા.૨૮/૧૦/૨૦૨૧ ના રોજ પત્ર દ્વારા તેમનું બેંક એકાઉન્ટ નં.૦૫૮૮૦૨૦૦૦૦૧૩૯૩ બંધ કરવા અને આ બેંક એકાઉન્ટ ના તમામ ચેક કેન્સલ કરવા તેમની બેંકને વિનંતી કરેલ હોવાનું જણાય છે અને આ પત્ર આધારે આરોપીનું બેંક એકાઉન્ટ તા.૨૮/૧૦/૨૦૨૧ ના રોજ કલોઝ કરવામાં આવેલું છે તેવું બેંક સ્ટેટમેન્ટ જોતાં જણાઈ આવે છે. આમ, આરોપીનું બેંક ખાતું તા.૨૮/૧૦/૨૦૨૧ ના રોજ બંધ કરવામાં આવેલું છે, જ્યારે તકરારી ચેક જોતાં તે તા.૨૩/૫/૨૦૨૨ ના રોજનો છે. આમ, તકરારી ચેક "એકાઉન્ટ કલોઝડ" થયા બાદ આપવામાં આવેલો છે તે પ્રથમદર્શનીય જણાય છે અને તેના સંદર્ભમાં ચેક રીટર્નમેમામાં કારણ " " 88-CHQ UNUSABLE " જણાવેલાનું માનવાને કારણ છે. આમ, સદરહુ હકીકત જોઈએતો, જો ખાતાધારકે પોતાની સુચનાથી બેંક ખાતું બંધ કર્યું હોય અને ત્યારબાદ તે બંધ ખાતામાંથી ચેક જારી કર્યો હોય તો તે ભંડોળની અપૂર્ણતા તરીકે ગણી શકાય છે અને તેથી તેથી આ કામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ લાગુ પડે છે તેવું અત્રેની કોર્ટનું સ્પષ્ટપણે માનવું છે. સદરહુ હકીકત સંદર્ભે NEPC MICON LTD. V/S MAGMA LEASING LTD. AIR 199 SC 1952 નો ન્યાય નિર્ણય નમ્રપણે વંચાણે લેતાં તેમાં પણ ઠરાવેલું છે કે, ચેક રીટર્નનું કારણ "એકાઉન્ટ કલોઝડ" હોય તો

ચેક પરત કરવાનો અર્થ એ છે કે, કલમ-૧૩૮ માં કલ્પના કર્યા મુજબ, તે ખાતામાં જમા થયેલી રકમ ચેકને સ્વીકારવા માટે અપુરતી છે. વધુમાં, દાદા સીલ્ક મીલ્સ વિરુદ્ધ ઈન્ડિયન ઓવરસીઝ બેંક એન્ડ બેંકીંગ કંપની સુરત ૧૯૯૫(૧) જી.એલ.એચ.૪૫૮ તથા જે.વીરરાઘવન વિરુદ્ધ લલીથ કુમાર ૧૯૯૪ એસસીસી ઓનલાઈન મદ્રાસ ૫૬૭ તથા લક્ષ્મી ડાયકેમ વિરુદ્ધ સ્ટેટ ઓફ ગુજરાત ૨૦૧૨(૧૩)એસસીસી ૩૭૫ નો ન્યાય નિર્ણય નમ્નપણે વંચાણે લેતાં પણ આ કામે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ લાગુ પડે છે તેવું અત્રેની કોર્ટનું સ્પષ્ટપણે માનવું છે. વધુમાં, ફરીયાદીનું બેંક ખાતું મોરબી મુકામે એટલેકે, અત્રેની કોર્ટની હકુમતમાં આવેલું છે અને તકરારી ચેક અત્રેની કોર્ટ ની હકુમતમાં આવેલી બેંકમાં વસુલાત માટે રજુ કરેલો છે. વધુમાં, ફરીયાદીની ફરીયાદ, ફરીયાદીનું વેરીફિકેશન, સોગંદનામું, રજુ થયેલા દસ્તાવેજી પુરાવા ધ્યાને લેતાં સદરહુ ફરીયાદ સમયમર્યાદામાં દાખલ કરેલાનું પણ જણાઈ આવે છે. આમ, સદરહુ તમામ હકીકત અને સંજોગો ધ્યાને લેતાં આ કામના આરોપી સામે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ- ૧૩૮ અન્વયેના ગુના સબબ ઈન્સાફી કાર્યવાહી ચલાવવા માટે પુરતા કારણો જણાતા હોઈ સદરહુ ફરીયાદ ક્રિમીનલ કેસ રજીસ્ટરે નોંધવાનો આદેશ કરવામાં આવે છે અને આ કામના આરોપી સામે બી.એન.એસ.એસ.૨૦૨૩ ની કલમ-૨૨૭ (ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૨૦૪)અન્વયે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ ના ગુના સબબ ફરીયાદીએ પ્રોસેસ ફી ભર્યેથી તેમજ સદરહુ ફરીયાદ તથા જરૂરી દસ્તાવેજોની કોપી રજુ કર્યેથી મુદત તા.૩૦/૦૬/૨૦૨૬ ના રોજનો સમન્સ ઈસ્યુ કરવાનો આદેશ કરવામાં આવે છે.

હુકમ આજરોજ તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી જાહેર કર્યો.

મુ.મોરબી
તા.૧૫/૦૬/૨૦૨૬

(જીતેન્દ્રકુમાર જયંતિલાલ જોષી)
ત્રીજા એડીશનલ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ
મોરબી
જજ કોડ- જીજે ૦૧૨૭૧